

ટેક્સ ટુડે

Tax Today (Monthly)

(ટેક્સ સંલગ્ન તથા અન્ય મહત્વના સમાચાર પ્રસિદ્ધ કરતું માસિક)

RNI No.GUJGUJ/2016/74805

e-mail: taxtodayuna@gmail.com

e-mail: editor@taxtoday.co.in

www.taxtoday.co.in

પ્રતિશ્રી,

◆ વર્ષ: ૧૦ ◆ અંક: ૯ ◆ સળંગ અંક: ૧૧૫ ◆ તા.૧૮/૦૭/૨૦૨૬, શનિવાર ◆ પાના-૪ ◆ છૂટક અંકની કિંમત રૂ.૨૦ ◆ વાર્ષિક લવાજમ રૂ.૨૦૦/- (કુટીર સાથે રૂ.૩૦૦/-)

◆ તંત્રી-માસિક અને પ્રકાશક: ભવ્ય ટિપકભાઈ પોપટ

◆ પ્રકાશન સ્થળ: ૨૦૨-૨૦૩, ઘુપ કોમ્પ્લેક્સ, પોલીસ લાઈન સામે, ઉના, જી.ગીર સોમનાથ-૩૬૨૫૬૦

◆ ફોન : ૦૨૮૭૫-૨૨૧૭૦૦, ફેક્સ: ૦૨૮૭૫-૨૨૧૭૦૦, મો. : ૯૯૨૪૧ ૨૧૭૦૦

◆ મુદ્રણ સ્થળ : પ્રથમેશ ઓફસેટ, ગોંદરા ચોક, ઉના.

Post. Regn. No. G-JND/338/2020-2022. - Office of posting Una Post Office on 3rd Monday of Every Month

ઘ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશનની ૭૨મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદ ખાતે યોજાઈ

દેવકરણ વધાસીયાને સર્વાનુમતે સંસ્થાના પ્રમુખ તરીકે કરવામાં આવ્યા પસંદ. ભવ્ય પોપટ, બન્યા સંસ્થાના આઉટ સ્ટેશન વાઈસ પ્રેસીડન્ટ

વાર્ષિક અહેવાલ, હિસાબો અને વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજૂર; વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવી મેનેજિંગ કમિટીની વરણી



અમદાવાદ, તા. ૧૬ જુલાઈ ટેક્સ પ્રેક્ટિશનર્સના અગ્રણી સંગઠન ધી ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશનની ૭૨મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર, તા. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ અમદાવાદના વજ્રાપુર સ્થિત એચ.ટી. પારેખ હોલ (AMA) ખાતે મોટી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. એસોસિયેશનના વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન થયેલા વિવિધ શૈક્ષણિક, વ્યાવસાયિક અને પ્રતિનિધિત્વાત્મક કાર્યોની સમીક્ષા સાથે આગામી વર્ષ માટેની દિશા નક્કી કરતી આ બેઠક સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. સભામાં સૌપ્રથમ અગાઉ

યોજાયેલી ૭૧મી વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહીનું અનુમોદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન એસોસિયેશન દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનો વિસ્તૃત વાર્ષિક અહેવાલ તેમજ નાણાકીય હિસાબો સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભ્યોએ ચર્ચા બાદ સ્વીકાર્યા હતા. આગામી વર્ષ માટે ઓડિટરની નિમણૂક સહિતના એજન્ડાના વિવિધ મુદ્દાઓ પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.

સભામાં એસોસિયેશનના માસિક સ્ટેટ ટેક્સ જર્નલની કામગીરીનો અહેવાલ પણ રજૂ

કરવામાં આવ્યો હતો. ઉપરાંત વર્ષ દરમિયાન ઉત્તમ લેખન કરનાર લેખકોને ટ્રોફી એનાયત કરવાની સાથે સભ્યોના સંતાનોને વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ બદલ વિવિધ સ્મૃતિ પારિતોષિકો અને મેરિટ એવોર્ડ્સ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. રમતગમત ક્ષેત્રે

ચેસ, કેરમ અને ક્રિકેટ સ્પર્ધાઓના વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન એસોસિયેશને રિફ્રેશર કોર્સ, જ્ઞાનોદય પાઠશાળા, વેબિનાર, મોડુલ્સિસ કાર્યક્રમો, રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સ, આઉટરીચ કાર્યક્રમો તેમજ GST અને કરવેરા સંબંધિત

વિવિધ પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અસરકારક રજૂઆતો કરીને સભ્યોના હિતોની રક્ષા માટે નોંધપાત્ર કામગીરી કરી હોવાનું સભામાં જણાવાયું હતું. વાર્ષિક અહેવાલમાં આ તમામ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. સભામાં એસોસિયેશનના

નવા મોટ્ટો સોંગ, એમ્પાવર્ડ કમિટી અને ડિસ્ચુટ રિફ્રેસલ કમિટીની પુનરચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઝોનવાઈઝ એસોસિયેટ સભ્યો જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

(અનુસંધાન રજા પાને)

સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિયેશન સુરતના હોદ્દેદારોને હાર્દિક શુભેચ્છા



એડવોકેટ
શશાંક એમ. મીઠાઈપાલા
પ્રમુખ



CA
મનીષ એસ. મહેતા
વાઈસ પ્રેસીડન્ટ



CA
રોનક એન. પારેખ
સેક્રેટરી



એડવોકેટ
તિલક એમ. મુક્તીપાલા
જોઈન્ટ સેક્રેટરી

શુભેચ્છક:- ટેક્સ ટુડે પરિવાર

ઘ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિયેશનના તમામ હોદ્દેદારોને હાર્દિક શુભેચ્છા



એડવોકેટ
દેવકરણ વધાસીયા
પ્રમુખ



એડવોકેટ
રાજુપ શાહ
ઉપ પ્રમુખ



એડવોકેટ
ભવ્ય પોપટ
ઉપ પ્રમુખ આઉટસ્ટેશન



એડવોકેટ
નિખિલ ગાંધી
હોન. સેક્રેટરી



એડવોકેટ
બાબુભાઈ ઓઝા
સેક્રેટરી આઉટસ્ટેશન



એડવોકેટ
નિશાંત શાહ
ખજાનચી

શુભેચ્છક:- ટેક્સ ટુડે પરિવાર

ડીલે કોન્ડોનેશન બાબતે રાજસ્થાન હાઈકોર્ટનો આવકારદાયક ચુકાદો GST અપીલમાં વિલંબ છતાં મળશે ન્યાયનો મોકો: રાજસ્થાન હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય



તા.૭-૭-૨૦૨૬

GST હેઠળ અપીલ દાખલ કરવામાં વિલંબ થયો હોય તો દરેક કિસ્સામાં કરદાતાનો ન્યાય મેળવવાનો અધિકાર સમાપ્ત થઈ જતો નથી. રાજસ્થાન હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો વિલંબ પાછળ વાજબી અને અસાધારણ કારણો હોય તો કરદાતાને માત્ર સમયમર્યાદાના આધારે ન્યાયથી વંચિત રાખી શકાય નહીં.

આ નિર્ણય M/s Rajoria Bharat Gas Vs. Union of India Others કેસમાં આપવામાં આવ્યો છે, જે સમગ્ર દેશના GST કરદાતાઓ માટે મહત્વનો માર્ગદર્શક બની શકે છે.

શું હતો સમગ્ર મામલો?

અરજદાર રાજોરિયા ભારત ગેસ સામે GST વિભાગે CGST Actની કલમ ૭૩ હેઠળ વધારાની કર માંગનો આદેશ પસાર કર્યો હતો. કાયદા મુજબ

આવા આદેશ સામે કલમ ૧૦૭ હેઠળ નિધારિત સમયમર્યાદામાં અપીલ કરવી જરૂરી છે.

પરંતુ કરદાતા સમયસર અપીલ કરી શક્યા નહોતા. પરિણામે GST પોર્ટલે તેમની અપીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો.

કરદાતાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી કે:

- તેમના ટેક્સ કન્સલ્ટન્ટ ગંભીર રીતે બીમાર થઈ ગયા હતા.
- તેથી તેઓ સમયસર આદેશની જાણ કરાવી શક્યા નહોતા.
- બીજી તરફ ગલ્ફ યુદ્ધને કારણે દેશમાં LPGની અછત સર્જતા વેપારી તરીકે ગેસ સપ્લાયનું ભારે દબાણ હતું, જેના કારણે તેઓ સમયસર આદેશની માહિતી મેળવી શક્યા નહોતા.

વિભાગે શું દલીલ કરી?

GST વિભાગે દલીલ કરી કે જો કન્સલ્ટન્ટને આદેશની જાણ થઈ ગઈ

સલાહકારની બીમારી અને અસાધારણ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે વિલંબ માફ કર્યો-હવે અપીલ ગુણદોષના આધારે સાંભળવાનો આદેશ

હોય તો કાયદાની દૃષ્ટિએ કરદાતાને પણ જાણ થઈ ગઈ હોવાનું માનવું જોઈએ. તેથી વિલંબ માફ કરી શકાય નહીં.

હાઈકોર્ટે શું કહ્યું?

હાઈકોર્ટે વિભાગની આ દલીલ સ્વીકારી નહોતી.

કોર્ટે નોંધ્યું કે:-

- આ કેસ કલમ ૭૩નો છે, જેમાં છેતરપિંડી (Fraud)નો કોઈ આરોપ નથી.
- કરદાતા પર વધારાનો કર ખરેખર લાગુ પડે છે કે નહીં તેનો નિર્ણય ગુણદોષના આધારે થવો જોઈએ.
- માત્ર સમયમર્યાદાના કારણે કરદાતાને અપીલનો અધિકાર ગુમાવી દેવું યોગ્ય નથી.
- જો અપીલની તક જ ન મળે તો કરદાતા ન્યાય મેળવવાના મૂળભૂત અધિકારથી વંચિત રહી જશે.

અગાઉના ચુકાદાઓનો પણ આધાર

હાઈકોર્ટે જણાવ્યું કે આ મુદ્દે અગાઉ પણ અનેક કેસોમાં સમાન અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમાં મુખ્યત્વે:

- M/s Makkhan Lal Sons
- Jagdamba Motors
- Komal Marble
- World Trade Park Ltd.
- Ramesh Chand Ramavtar

• Uttam Prakash તથા સર્વોચ્ચ અદાલતના Tecnimont Pvt. Ltd. Vs. State of Punjab (2021)ના ચુકાદાનો પણ આધાર લેવામાં આવ્યો.

અંતે હાઈકોર્ટે શું આદેશ આપ્યો?

- હાઈકોર્ટે:-
- અપીલ દાખલ કરવામાં થયેલો વિલંબ માફ કર્યો.
- કરદાતાને ૧૫ દિવસની અંદર નવી અપીલ દાખલ કરવાની છૂટ આપી.
- અપીલ અધિકારીને સ્પષ્ટ સૂચના આપી કે સમયમર્યાદાના મુદ્દે અટક્યા વગર અપીલને ગુણદોષના આધારે સાંભળવી.
- કરદાતાની તમામ કાનૂની દલીલો પર કારણસભર (Speaking) Order પસાર કરવાનો પણ આદેશ આપ્યો.

સામાન્ય કરદાતાઓ માટે આ નિર્ણયનું મહત્વ

- આ ચુકાદો એ સંદેશ આપે છે કે:
- માત્ર ટેક્નિકલ કારણોસર ન્યાયનો દરવાજો બંધ થઈ જવો જોઈએ નહીં.
- જો વિલંબ પાછળ વાજબી અને પ્રામાણિક કારણો હોય તો હાઈકોર્ટે રાહત આપી શકે છે.
- જોકે આનો અર્થ એવો નથી કે દરેક

વિલંબ આપોઆપ માફ થઈ જશે. દરેક કેસ તેની પોતાની હકીકતોના આધારે નક્કી થશે.

- તેથી કરદાતાઓએ શક્ય હોય ત્યાં સુધી સમયમર્યાદામાં અપીલ કરવી જોઈએ, પરંતુ અસાધારણ સંજોગોમાં કાનૂની ઉપચારનો માર્ગ ખુલ્લો રહી શકે છે.

:- સંપાદક નોંધ :-

GST કાયદામાં અપીલ માટે સમયમર્યાદા ખૂબ કડક છે અને સામાન્ય રીતે તેની બહાર પોર્ટલ અપીલ સ્વીકારતું નથી. મેન્યુલ કરવામાં આવેલ અપીલ અપીલ અધિકારીઓ પણ કેસના ગુણદોષ જોયા વગર માત્ર વિલંબના કારણસર રદ કરી આપે છે. રાજસ્થાન હાઈકોર્ટનો આ નિર્ણય એ ન્યાયસંગત સિદ્ધાંતને આગળ વધારે છે કે “ન્યાયની તક માત્ર ટેક્નિકલ મર્યાદાઓના કારણે છીનવાઈ જવી જોઈએ નહીં.” જોકે, આ ચુકાદાને સામાન્ય નિયમ તરીકે નહીં પરંતુ અસાધારણ પરિસ્થિતિઓમાં મળતી ન્યાયિક રાહત તરીકે જોવો વધુ યોગ્ય રહેશે. આમ, કરદાતાએ પોતાની અપીલ સમયસર કરી આપવી જ જોઈએ. કોઈ કાનૂની બહારના સંજોગોમાં જો અપીલ સમયસર

-By Bhavya Popat

ધ ગુજરાત સ્ટેટ ટેક્સ બાર એસોસિએશન (અનુસંધાન પાના ૧થી શરૂ...)

AGMનું મુખ્ય આકર્ષણ વર્ષ ૨૦૨૬-૨૭ માટે એસોસિએશનની નવી મેનેજિંગ કમિટીની ચૂંટણી રહ્યું હતું. એજન્ડા મુજબ ૧૧ સભ્યોની નવી મેનેજિંગ કમિટીની વરણી કરવામાં આવી હતી, જે આગામી એક વર્ષ માટે એસોસિએશનની કામગીરીનું સુકાન સંભાળશે. નવી ટીમ પાસેથી વ્યાવસાયિક હિતોની રક્ષા, કરકાયદામાં જાગૃતિ, તાલીમ કાર્યક્રમો અને સરકાર સમક્ષ અસરકારક રજૂઆતોને વધુ ગતિ મળશે તેવી સભ્યોએ આશા વ્યક્ત કરી હતી. એસોસિએશનની નવી કારોબારીમાં દેવકરણ વઘાસિયા, આશુતોષભાઈ ઠક્કર, બાબુભાઈ ઓઝા, દર્શિત પી. શાહ, મેહુલ એન. શાહ, નિખિલ બી. ગાંધી, નિશાંત એમ. શાહ, પ્રિતેશ એસ. ગાંધી, રાહુલ ડી. ભાવસાર, રાજીવ શાહ, અરવિંદભાઈ પટેલ ની નિમણૂક થયેલ છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ એસોસિએટ એસોસિએશનના સભ્યો તરીકે નડિયાદથી અમિત સોની, રાજકોટથી રાજેશ કુકડિયા, વાપીથી ચિરાગભાઈ ગાંધી, ડીસાથી રાજેશભાઈ ઠક્કર અને ઉનાથી ભવ્ય પોપટની નિમણૂક થયેલ છે. સાધારણ સભા બાદ મળેલ પ્રથમ કારોબારી સભામાં પ્રમુખ તરીકે અમદાવાદના જાણીતા એડવોકેટ દેવકરણ વઘાસિયાની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેક્સ ટુડેના તંત્રી ભવ્ય પોપટની સંસ્થાના વાઈસ પ્રેસીડન્ટ આઉટરેશન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ કારોબારી સમિતિની બીજી બેઠકમાં સંસ્થાના સેક્રેટરી તરીકે નિખીલભાઈ ગાંધી, સેક્રેટરી આઉટરેશન તરીકે બાબુભાઈ ઓઝા, ખજાનચી તરીકે નીશાંતભાઈ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સભાના અંતે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ટેક્સ પ્રોફેશનલ્સના હિતો, વ્યાવસાયિક જ્ઞાનના વિકાસ તથા સમાજસેવાના ક્ષેત્રે એસોસિએશનની કામગીરીને વધુ વ્યાપક બનાવવાના સંકલ્પ સાથે વાર્ષિક સામાન્ય સભાનું સમાપન કરવામાં આવ્યું હતું.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

સઘર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જાણીતા એડવોકેટ શશાંક મીઠાઈવાલાની ફરી પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી

સુરત, તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬
ધી સઘર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન, સુરત દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનની ૬૫મી વાર્ષિક સાધારણ સભા, તા. ૨૮ જૂન, ૨૦૨૫ના રોજ યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું

એસોસિએશનના સચિવ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

- નવી કારોબારીમાં નીચે મુજબ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે:
- પ્રમુખ: શ્રી શશાંક એમ. મિઠાઈવાલા
- ઉપપ્રમુખ: શ્રી મનીષ એસ. મહેતા
- સચિવ: શ્રી રોનક પારેખ
- સંયુક્ત સચિવ: શ્રી તિલક એમ. મુકાતીવાલા

ઉલ્લેખનીય છે કે સઘર્ન ગુજરાત

કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન સુરતના અગ્રણી કરવ્યવસાયિકોની સંસ્થા છે અને રાજ્યના કર કાયદા, જીએસટી તેમજ આવકવેરા સંબંધિત મુદ્દાઓ પર સભ્યોના હિતમાં સતત કાર્યરત રહી છે. નવી કારોબારીના નેતૃત્વ હેઠળ એસોસિએશન કરક્ષેત્રના વ્યાવસાયિકો માટે વધુ અસરકારક કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

GSTAT અપીલ ફાઇલિંગમાં મોટી રાહત: જાણો 'ટોકન સિસ્ટમ' શું છે અને તે શા માટે મહત્વપૂર્ણ છે?



-By Darshit Shah,
Advocate

GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT)માં અપીલ દાખલ કરતા કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. GSTAT દ્વારા ૧૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ 'ઓર્ડર નંબર ૧૫૬/૨૦૨૬' બહાર પાડવામાં આવ્યો છે, જેમાં અપીલ ફાઇલ કરવા માટે એક નવી 'ટોકન સિસ્ટમ' (Token Mechanism) રજૂ કરવામાં આવી છે. જે કરદાતાઓને ઓનલાઈન પોર્ટલ પર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમના માટે આ સિસ્ટમ ખૂબ જ ફાયદાકારક છે.

આ ટોકન સિસ્ટમ શા માટે મહત્વપૂર્ણ છે?

- સમય મર્યાદાની સુરક્ષા (Protecting the Timeline): GSTATમાં અપીલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. જો તમે ૩૧ જુલાઈ ૨૦૨૬ કે તે પહેલાં ટોકન જનરેટ કરી લો છો, તો તે સરકારમાં નોંધાય છે કે તમારો અપીલ કરવાનો ઇરાદો (intent to file) હતો.
- વિલંબ ફી (Delay Fee)માંથી મુક્તિ: જો પોર્ટલની ખામી કે અન્ય કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે તમે સમયસર અપીલ ફાઇલ ન કરી શકો, અને તમારી પાસે માન્ય ટોકન હશે, તો તમને વિલંબ ફી ભરવામાંથી મુક્તિ મળશે.
- સરળ શબ્દોમાં કહીએ તો, ૩૧ જુલાઈ પહેલા મેળવેલું ટોકન એ નિયત તારીખમાં અપીલ દાખલ કરવા માટેનું "પર્યાપ્ત પાલન" (sufficient compliance)



માનવામાં આવશે.

ધ્યાનમાં રાખવા જેવી અગત્યની બાબતો (મુખ્ય નિયમો):

- ૬૦ દિવસની મુદત: ટોકન જનરેટ કર્યાની તારીખથી ૬૦ દિવસની અંદર તમારે તમારી સંપૂર્ણ અપીલ (actual filing) દાખલ કરવી ફરજિયાત છે.
- ટોકન રદ થવું (Lapse): ૬૦ દિવસ પૂરા થયા પછી આ ટોકન આપોઆપ રદ (lapse) થઈ જશે, અને ત્યારબાદ તેના આધારે કોઈ ફાઇલિંગ સ્વીકારવામાં આવશે નહીં.
- દરેક અપીલ માટે અલગ ટોકન: જો તમારે એક કરતા વધુ અપીલ દાખલ કરવાની હોય, તો દરેક અપીલ માટે અલગ ટોકન જનરેટ કરવું પડશે. એક ટોકનનો ઉપયોગ બહુવિધ અપીલો માટે કરી શકાશે નહીં.
- માહિતીની ચોકસાઈ: જો ટોકન જનરેટ કરતી વખતે અધૂરી કે ખોટી માહિતી આપવામાં આવશે, તો તે ટોકન રદ (Void) ગણવામાં આવશે. આથી અપીલકર્તાઓએ ખૂબ જ સાવચેતી રાખીને ફોર્મ ભરવું.

પાસ નોંધ: ટોકન માત્ર તમારી

ફાઇલિંગની સમય મર્યાદાને સુરક્ષિત કરે છે, તે સંપૂર્ણ અપીલ ફાઇલિંગનો વિકલ્પ નથી.

ટોકન કેવી રીતે જનરેટ કરવું?

GSTAT પોર્ટલ (<https://efiling.gstat.gov.in>) પર જઈને નિર્ધારિત ફોર્મમાં જરૂરી માહિતી ભરવાની રહેશે. જો તમારી પાસે અપીલનો ઓર્ડર ઓનલાઈન ઉપલબ્ધ હોય, તો ૧૬-આંકડાનો ARN/CRN નંબર આપવાનો રહેશે અને જો ઓર્ડર ઓનલાઈન ન હોય તો ઓર્ડર/રેકર્ડ નંબર અથવા ફાઇલ નંબર આપવાનો રહેશે. સફળતાપૂર્વક ફોર્મ સબમિટ કરવાથી તારીખ અને સમય સાથેનું એક 'ટોકન ID' જનરેટ થશે.

કરદાતાઓ માટે સલાહ: તમામ કરદાતાઓ અને તેમના પ્રતિનિધિઓને અપીલ કરવામાં કોઈ અડચણ ન આવે તે માટે વિનંતી છે કે તેઓ ૩૧ જુલાઈ ૨૦૨૬ પહેલાં પોતાનું ટોકન જનરેટ કરી લે અને તેની નોંધ (રેકોર્ડ) પોતાની પાસે સુરક્ષિત રાખે.

ઈન્કમેટેક્સના એકાઉન્ટનાં ડેઈલી બેકઅપ લેવાના નિયમની સરળ ભાષામાં સમજૂતી



By Prashant Makvana,
Tax Consultant

પ્રસ્તાવના:

ઈન્કમેટેક્સ એક્ટ-૨૦૨૫ જે ૦૧/૦૪/૨૦૨૬ થી અમલમાં આવી ગયો છે જે અંતર્ગત ઈન્કમેટેક્સ રૂલ ૨૦૨૬માં RULE 46(8) છે જેમાં ઇલેક્ટ્રોનિક્સ બુક્સ ઓફ એકાઉન્ટ નું ડેઈલી બેકઅપ અને ભારતમાં લોકેટેડ હોય તેવા સરવર માં સેવ કરવા માટે નો છે આ આર્ટિકલ માં આપણે RULE-46(8)ની સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી છે.

● RULE-46(8)

RULE-46(8) મુજબ જે કરદાતા સેક્શન ૬૨ મુજબ બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ ઇલેક્ટ્રોનિક મોડમાં રાખતા હોય તો તે ભારતમાં દરેક સમયે ઉપલબ્ધ રહેવા જોઈએ અને આવા બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટનું દરરોજ એક નિયત સમયે બેકઅપ લેવાનું અને આ બેકઅપનું સરવર ફરજિયાત ભારતમાં જ હોવું જોઈએ.

- સેક્શન-૬૨ મુજબ બુક્સ ઓફ

એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ કોને રાખવા ફરજિયાત છે?

૧. કરદાતા ઈન્ડિવીજ્યુઅલ અને HUF હોય તો પાછલા ત્રણ વર્ષ માંથી કોઈ પણ એક વર્ષ માં જો ઈન્કમ ૨.૫ લાખ થી વધુ હોય

અથવા

ટર્ન ઓવર ૨૫ લાખથી વધુ હોય તો બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા ફરજિયાત છે.

૩. કોઈપણ કરદાતા નીચેનામાંથી કોઈપણ સ્પેસિફિક વ્યવસાયમાં જોડાયેલ હોય તો ઉપરોક્ત ઈન્કમ અથવા ટર્નઓવર ની લીમીટ ને ધ્યાન રાખ્યા વગર ફરજિયાત બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવાના.

સ્પેસિફિક વ્યવસાય

- એડવોકેટ
- ડોક્ટર
- અન્જિનિયર



૨. ઈન્ડિવિજ્યુઅલ અને HUF સિવાયના કરદાતાની પાછલા ત્રણ વર્ષ માંથી કોઈ પણ એક વર્ષમાં ઈન્કમ ૧.૨ લાખ થી વધારે થાય,

અથવા

સેલ્સ/ટર્નઓવર/ગ્રોસ રીસીપ્ટ ૧૦ લાખથી વધારે થાય તો. બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા ફરજિયાત છે.

- આર્કિટેક્ટ
- કોસ્ટ એકાઉન્ટન્ટ
- કંપની સેક્રેટરી
- ટેકનીકલ કન્સલ્ટન્ટ
- ઈન્ટેવિયર ડેકોરેટર
- ઈન્ફોર્મેશન ટેકનોલોજી પ્રોફેશનલ
- ઈન્ડિવિજ્યુઅલ અને HUF કરદાતા જો નવો ધંધો શરૂ કરતા હોય તો જે વર્ષમાં ધંધો શરૂ કરે છે તે વર્ષ ના

અનુમાન મુજબ જો ઈન્કમ ૨.૫ લાખથી વધુ હોય

અથવા

ટર્નઓવર ૨૫ લાખથી વધુનું હોય તો ફરજિયાત બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા પડે.

૫. ઈન્ડિવિજ્યુઅલ અને HUF સિવાયના કરદાતા જો નવો ધંધો શરૂ કરતા તો જે વર્ષમાં ધંધો શરૂ કરે છે તે વર્ષના અનુમાન મુજબ જો ઈન્કમ ૧.૨ લાખ થી વધુ હોય.

અથવા

ટર્નઓવર ૧૦ લાખથી વધુ હોય તો બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ ફરજિયાત મેન્ટેઈન કરવા પડે.

૬. ઈન્કમેટેક્સ એક્ટ-૨૦૨૫ની સેક્શન ૫૮(૨) અથવા ૬૧(૨) મુજબ કોઈ કરદાતા PRESUMPTIVE TAXATION SCHEME મુજબ જે મીનીમમ નફો રાખવાનો છે તેનાથી ઓછો નફો હોય તો ફરજિયાત બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન કરવા પડે. આપણે જોયું તે મુજબ કરદાતા ફરજિયાત બુક્સ ઓફ એકાઉન્ટ રાખવા જવાબદાર છે, તે કરદાતા એ જો ઇલેક્ટ્રોનિક મોડમાં બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેઈન કરતા હોય તો તે ભારતમાં દરેક સમયે ઉપલબ્ધ રહેવા જોઈએ અને તેની ડેઈલી એક નિયત સમયે બેકઅપ ભારતમાં સરવર હોય

તેમાં લેવું ફરજિયાત છે.

- RULE-46(8) નહિ ફાઇલો કરવાની પેનલ્ટી.

૧. કરદાતા ઉપર પેનલ્ટી

જો કરદાતા સેક્શન ૬૨ અને RULE-46(8) મુજબ બુક્સ ઓફ એકાઉન્ટ અને અન્ય ડોક્યુમેન્ટ મેન્ટેઈન નો કરે તો એસેસિંગ ઓફિસર અથવા જોઈન્ટ કમીશનર અથવા કમીશનર દ્વારા ૨૫ હજાર ની પેનલ્ટી લગાડી શકે.

આ ૨૫૦૦૦ ની પેનલ્ટી એક ડીક્રીટ માટે ગણવામાં આવે એટલે જો વર્ષ ૨૬૫ દિવસ બેકઅપ લેવાનું હોય અને તેમાંથી ૫૦ દિવસ બેકઅપ નથી લીધું તો ૨૫૦૦૦x૫૦=૧૨,૫૦,૦૦૦ ની પેનલ્ટી લાગી શકે.

૨. ઓડીટર ઉપર પેનલ્ટી.

ઈન્કમેટેક્સ એક્ટ ૨૦૨૫ મુજબ ઓડીટ માટેનું ફોર્મ ૨૬ છે જેમાં RULE-46(8) મુજબનું રીપોર્ટિંગ કરવાની અલગ કોલમ છે જો ઓડીટર આ ફોર્મમાં ખોટું રીપોર્ટિંગ કરે તો ઓડીટરને પણ ૧૦૦૦૦ની પેનલ્ટી લાગી શકે છે.

ટેક્સ પેયર ૨૦૨૬-૨૭માં એટલે કે ૧/૪/૨૦૨૬ થી આ નિયમ અમલમાં છે એટલે કે દરેક એકાઉન્ટન્ટ અને વેપારી મિત્રોએ ખાસ કાળજી લેવી જોઈએ કે RULEનું પાલન થાય જેથી કરીને પેનલ્ટી થી બચી શકાય.

આવકવેરા રિટર્ન ભરતી વખતે આ બાબતો પર રાખો ખાસ ધ્યાન

આવકવેરા રિટર્ન (Income Tax Return-ITR) ભરવાની પ્રક્રિયા હવે માત્ર વાર્ષિક ઔપચારિકતા રહી નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા વિભાગે માહિતી એકત્રિત કરવાની અને તેનું વિશ્લેષણ કરવાની પોતાની ક્ષમતામાં અસાધારણ વધારો કર્યો છે તેવું કહી શકાય છે. આજે બેંકો, GST નેટવર્ક, રજિસ્ટ્રેશન વિભાગ, સ્ટોક એક્સચેન્જ, મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપનીઓ, વિદેશી નાણાકીય સંસ્થાઓ તેમજ અન્ય અનેક સરકારી અને ખાનગી એજન્સીઓ વગેરે પાસેથી મળતી માહિતીના આધારે ઇન્કમ ટેક્સ વિભાગ કરદાતાના ભરવામાં આવેલ રિટર્નની ચકાસણી કરે છે. કરદાતા દ્વારા ભરવામાં આવેલ ઇન્કમ ટેક્સ રિટર્ન અને આ માહિતીમાં કોઈ ફેરફાર જણાય તો કરદાતાને આ અંગે નોટીસ આપી ખુલાસા માંગવામાં આવતા હોય છે. આ તકે એ જાણવું જરૂરી છે કે આ માહિતી અને ઇન્કમ ટેક્સ રિટર્નની આ ચકાસણી એ કોઈ વ્યક્તિ દ્વારા નહિ પરંતુ AI એટલે કે આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સની મદદથી કરવામાં આવતી હોય છે. આથી હવે “જે આવક દેખાશે નહીં તેની ખબર વિભાગને નહીં પડે” એવી માન્યતા સંપૂર્ણપણે જૂની બની ગઈ છે.

આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ કલમ ૧૩૮ મુજબ યોગ્ય રિટર્ન ભરવાની જવાબદારી કરદાતાની છે. જો રિટર્નમાં આવક, સંપત્તિ અથવા અન્ય વિગતો અધૂરી કે ખોટી દર્શાવવામાં આવે તો તે ભવિષ્યમાં નોટિસ, દંડ, વ્યાજ અથવા ગંભીર કિસ્સાઓમાં પ્રોસિક્યુશનનું કારણ પાડી શકે છે.

૧. તમામ આવક જાહેર કરવી એ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ જવાબદારી

ઘણા કરદાતાઓ માત્ર પગાર અથવા વ્યવસાયની આવક દર્શાવીને રિટર્ન પૂર્ણ કરી દે છે, જ્યારે અન્ય ઘણી આવકો જાહેર કરવામાં આવતી નથી.

રિટર્નમાં નીચેની તમામ આવકોનો સમાવેશ થવો જોઈએ:

- પગારની આવક
 - વ્યવસાય અથવા વ્યવસાયિક આવક
 - બેંક સેવિંગ્સ અને FD ઉપરનું વ્યાજ
 - ડિવિડન્ડ
 - ભાડાની આવક
 - શેર, મ્યુચ્યુઅલ ફંડ અથવા મિલકત વેચાણ પરથી થયેલો કેપિટલ ગેઈન
 - કમિશન, બ્રોકરેજ અથવા કન્સલ્ટન્સી આવક
 - ફીલાન્સ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મળેલી આવક
 - વિદેશમાંથી પ્રાપ્ત થયેલી આવક
 - અન્ય કોઈપણ સ્ત્રોતથી પ્રાપ્ત આવક
- ઘણા લોકો માને છે કે TDS કપાઈ ગયો હોવાથી જે તે આવક જાહેર કરવાની જરૂર નથી. હકીકતમાં TDS એ માત્ર ટેક્સની પૂર્વ વસૂલાત છે; આવક જાહેર કરવાની ફરજ તેનાથી સમાપ્ત થતી નથી. TDS કાપી આવક

આવકવેરા રીટર્ન ભરવા માટે નોકરિયાત કરદાતાઓ ૩૧ જુલાઈ છે તથા માટે ધંધાર્થીઓ માટે છેલ્લી તારીખ ૩૧ ઓગસ્ટ છે

યુક્તવનાર કરદાતા પોતાની જવાબદારી પૂરી કરે છે જ્યારે આ આવક રીટર્નમાં દર્શાવી આવક મેળવનાર કરદાતા આ આવક ઉપર પોતાની જવાબદારી પૂર્ણ કરે છે. એ બાબત જાણવી જરૂરી છે કે ઘણીવાર કરદાતા જે તે આવક ઉપર TDS કપાઈ હોવા છતાં વધુ રકમ ટેક્સ તરીકે ભરવા જવાબદાર બનતા હોય છે. આમ, TDS કપાત થઈ હોય તેવી આવક પણ પોતાના રીટર્નમાં દર્શાવવી જરૂરી છે.

૨. AIS, TIS અને Form 26AS સાથે રિટર્નનો મેળ બેસાડવો

આવકવેરા વિભાગ હવે Annual Information Statement (AIS) અને Taxpayer Information Summary (TIS)ના આધારે કરદાતાની લગભગ તમામ નાણાકીય માહિતી એકત્રિત કરે છે. આ માહિતી કરદાતાને આપવામાં પણ આવે છે. AISમાં સામાન્ય રીતે નીચેની વિગતો જોવા મળે છે:

- TDS અને TCS
- બેંક વ્યાજ
- ડિવિડન્ડ
- શેર અને મ્યુચ્યુઅલ ફંડના વ્યવહારો
- મિલકતની ખરીદી અને વેચાણ
- ઊંચી કિંમતના નાણાકીય વ્યવહારો (SFT)

● વિદેશી રેસિડન્સ

● અન્ય અનેક નાણાકીય માહિતી

રિટર્ન ભરતા પહેલાં AIS, TIS અને Form 26AS સાથે પોતાની ખાતાવહી તથા બેંક સ્ટેટમેન્ટનો મેળ બેસાડવો અત્યંત જરૂરી છે. જો AISમાં દર્શાવેલી આવક રિટર્નમાં દર્શાવવામાં ન આવે તો વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ માંગતી નોટિસ મળવાની શક્યતા વધી જાય છે.

૩. વ્યવસાયિકો માટે બેલેન્સ શીટમાં તમામ સંપત્તિઓ દર્શાવવી અત્યંત જરૂરી

પ્રોપ્રાઇટરશી, પાર્ટનરશીપ ફર્મ, LLP અને કંપનીઓ માટે બેલેન્સ શીટ માત્ર એકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ નથી પરંતુ વ્યવસાયની નાણાકીય સ્થિતિનો કાયદેસર દસ્તાવેજ છે. ઘણા વેપારીઓ માત્ર નફો ઓછો બતાવવા પર ધ્યાન આપે છે પરંતુ સંપત્તિઓ યોગ્ય રીતે દર્શાવતા નથી.

બેલેન્સ શીટમાં નીચે મુજબની તમામ સંપત્તિઓનો સમાવેશ થવો જોઈએ:

- જમીન અને મકાન
- ઓફિસ અને ફેક્ટરી બિલ્ડિંગ
- પ્લાન્ટ અને મશીનરી

- કમ્પ્યુટર, સર્વર અને IT સાધનો
- વાહનો
- ફર્નિચર અને ફિક્સચર
- સ્ટોક
- રોકડ
- બેંક બેલેન્સ
- ડેબ્ટર્સ
- લોન અને એડવાન્સ
- રોકાણ
- અન્ય ચલ અને અચલ સંપત્તિઓ

ઘણી વખત GST રેકૉર્ડ, ઇ-ઈન્વોઈસ, ઇ-વે બિલ, બેંક ફાઇનાન્સિંગ અથવા અન્ય દસ્તાવેજોમાં સંપત્તિની વિગતો ઉપલબ્ધ હોય છે. જો તે બેલેન્સ શીટમાં ન હોય તો ભવિષ્યમાં તેની ખરીદીના સ્ત્રોત, ડિમિસિયેશનના દાવા અથવા વેચાણ સમયે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. જો કે કરદાતા પોતાની અંગત અને ધંધાના ચોપડા અલગ નિભાવતા હોય તો તેઓ માત્ર ઇન્કમ ટેક્સ રીટર્નમાં

૫. વિદેશી સંપત્તિ અને વિદેશી બેંક ખાતાઓ જાહેર કરવાનું ભૂલશો નહીં

ભારતમાં Resident અને Ordinarily Resident (ROR) કરદાતાઓ માટે સૌથી સંવેદનશીલ મુદ્દો Schedule FA (Foreign Assets) છે.

જો કરદાતા પાસે નીચે પૈકી કોઈપણ સંપત્તિ હોય તો તેની વિગતો જાહેર કરવી જરૂરી બની શકે છે:

- વિદેશી બેંક ખાતું
- વિદેશમાં આવેલ ફ્લેટ અથવા જમીન
- વિદેશી કંપનીમાં શેર
- વિદેશી મ્યુચ્યુઅલ ફંડ
- વિદેશી ટ્રસ્ટમાં હિત
- વિદેશી પેન્શન ખાતું
- ESOP અથવા અન્ય નાણાકીય હિત
- અન્ય કોઈપણ વિદેશી સંપત્તિ

ઘણા લોકો એવું માને છે કે ખાતામાં બેલેન્સ નથી અથવા ખાતું વર્ષોથી ઉપયોગમાં નથી એટલે જાહેર કરવાની જરૂર નથી. આ ધારણા ખોટી છે. જો

કાયદા મુજબ જાહેર કરવાની ફરજ હોય તો Dormant Bank Accountની વિગતો પણ આપવી જરૂરી બની શકે છે.

૬. Black Money (Undisclosed Foreign Income and Assets) Act, 2015ની ગંભીર ખોજવાઈઓ

વિદેશી સંપત્તિ છુપાવવાના કિસ્સાઓ માટે માત્ર આવકવેરા અધિનિયમ જ નહીં પરંતુ Black Money (Undisclosed Foreign Income and Assets) and Imposition of Tax Act, 2015 પણ લાગુ પડી શકે છે.

આ કાયદા હેઠળ:

- ભારે કર અને દંડ વસૂલ થઈ શકે છે.
- ગંભીર કિસ્સાઓમાં ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.
- કેદની જોગવાઈ પણ છે.

ભારત હાલમાં અનેક દેશો સાથે Automatic Exchange of Information (AEOI) અને Common Reporting Standard (CRS) હેઠળ નાણાકીય માહિતીની આપ-લે કરે છે. પરિણામે વિદેશી બેંક ખાતા અને નાણાકીય રોકાણોની માહિતી ભારતીય કર સત્તાવાળાઓ સુધી પહોંચી શકે છે.

આથી વિદેશી સંપત્તિ છુપાવવાનો પ્રયાસ અત્યંત જોખમી બની શકે છે.

૭. કેપિટલ ગેઈનની યોગ્ય ગણતરી કરો

મિલકત, શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ

વેચાણ વખતે માત્ર વેચાણની રકમ દર્શાવવી પૂરતી નથી.

યોગ્ય રીતે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ:

- ખરીદીની કિંમત
- સુધારાના ખર્ચ
- ટ્રાન્સફર ખર્ચ
- લાગુ પડતી ઇન્ડેક્સેશન (જ્યાં લાગુ પડે)

● ઉપલબ્ધ મુક્તિઓ (જેમ કે કલમ 54, 54F, 54EC વગેરે)

ખોટી ગણતરીના કારણે વધારાનો ટેક્સ અથવા નોટિસ મળી શકે છે.

૮. કપાતો (Deductions) માત્ર યોગ્ય પુરાવા સાથે જ લો

કલમ 80C, 80CCD, 80D, 80G, 24(b), HRA વગેરે હેઠળ કપાતનો દાવો કરતાં પહેલાં તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોવા જોઈએ. ખોટા દાવા ભવિષ્યમાં દંડનું કારણ બની શકે છે.

૯. બેંક ખાતા, PAN અને આધારની વિગતો તપાસો

રિટર્ન સબમિટ કરતાં પહેલાં ખાતરી કરો કે:

- PAN સાચો છે.
- PAN અને Aadhaar લિંક થયેલા છે.

● મોબાઇલ નંબર અને ઇ-મેઇલ અપડેટ છે.

● બેંક ખાતું ટ્રી-વેલિડેટેડ છે.

● IFSC અને ખાતા નંબર સાચા છે.

રિક્ડમાં વિલંબનું સૌથી સામાન્ય કારણ ખોટી બેંક વિગતો હોય છે.

૧૦. રિટર્ન ભર્યા પછી ઇ-વેરિફિકેશન અવશ્ય કરો

ઘણા કરદાતાઓ રિટર્ન અપલોડ કરે છે પરંતુ તેનું ઇ-વેરિફિકેશન કરતા નથી. ખાસ કરીને જે કરદાતાઓ પોતાનું રિટર્ન જાતે ભરતા હોય તેવા કરદાતાઓને આ બાબતે કરદાતાઓને યોગ્ય માહિતી હોતી નથી. આ તકે એ જાણવું જરૂરી છે કે ઇ-વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ રિટર્ન કાયદેસર રીતે માન્ય ગણાય છે.

આવકવેરા વિભાગ હવે ડિજિટલ યુગમાં કાર્યરત છે, જ્યાં AIS, TIS, Form 26AS, SFT, GST, બેંકો, સ્ટોક એક્સચેન્જ, રજિસ્ટ્રેશન વિભાગ અને આંતરરાષ્ટ્રીય માહિતી વિનિમય વ્યવસ્થાઓ દ્વારા કરદાતાની નાણાકીય માહિતી સરળતાથી ઉપલબ્ધ બને છે. આથી રિટર્ન ભરતી વખતે માત્ર ટેક્સની ગણતરી પૂરતી નથી. દરેક આવક જાહેર કરવી, વ્યવસાયની તમામ સંપત્તિઓ બેલેન્સ શીટમાં સમાવવી, Schedule AL અને Schedule FA યોગ્ય રીતે ભરવી, વિદેશી બેંક ખાતા અને અન્ય વિદેશી સંપત્તિઓની વિગતો જાહેર કરવી તથા તમામ માહિતી AIS, TIS અને Form 26AS સાથે મેળ ખાય તેની ખાતરી કરવી એ દરેક કરદાતાની કાનૂની અને નૈતિક જવાબદારી છે. (આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યાપારભૂમિ પૃષ્ઠિમાં તા. ૬ જુલાઈ ૨૦૨૬ના રોજ પ્રકાશિત થયેલ છે.)